

નવસારી જિલ્લા પોલીસ તરફથી કરવામાં આવેલ સારી કામગીરીની વિગત

સાફલ્યગાથા તા.૧૯/૧૦/૨૦૨૦ થી ૨૫/૧૦/૨૦૨૦


વિક દરમિયાન કરેલ સારી કામગીરીની માસમાં નવસારી પોલીસે કરેલ સારી કામગીરી(સાફલ્યગાથા)ની વિગત.

કચેરી/ શાખા	કચેરી કામગીરીની વિગત
-------------	----------------------

તા.૧૯/૧૦/૨૦૨૦ ના રોજ નવસારી જિલ્લા પોલીસ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, મહિલા સુરક્ષા સમિતિની બહેનો તથા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલાઓ તથા બાળકીઓમાં સાયબર કાઇમ અંગેની જાગૃતિ આવે તે માટે સાયબર અંગેના જાણકાર શ્રી ચિરાગભાઈ લાડ દ્વારા મહિલા જાગૃતિ કાર્યક્રમ સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ સોશયલ ડિસ્ટન્ટનું પાલન થાય તે રીતે આયોજન કરવામાં આવેલ.



<p>એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડ</p>	<p>પોલીસ ગાંધીનગર દ્વારા પેરોલ-ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તેમજ જેલ ફરારી કેદીઓ-આરોપીઓને પકડી પાડવા સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલર/- ઉક્ત બાબતે નવસારી જિલ્લામાં સને : ૨૦૧૨માં નવસારી ટાઉન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૦૫/૨૦૧૨ આઇપીસી કલમ ૩૭૬, ૩૦૨, ૨૦૧ વિગેરે મુજબના ગુનામાં લાજપોર મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી નં. ૭૫૨ તરીકે આજીવન કેદની સજા હેઠળના આરોપી સંદીપભાઈ અશોકભાઈ વેતાળ રહે. રામનગર -૧, જયશક્તિ નગર જલારાજપોર જી.નવસારી મૂળ રહે. પારનેર જી.અહમદનગર મહારાષ્ટ્રનાઓ તા.૧૯/૦૬/૨૦૧૪ના રોજ લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતેથી દિન- ૧૫ની રજા લઇ રજા ઉપર આવેલ, અને પેરોલ રજા પરથી તા.૦૫/૦૭/૨૦૧૪ના રોજ હાજર થવાનું હતું, પરંતુ આરોપી રજા ઉપરથી હાજર ન થતાં આજદિન સુધી નાસતો ફરતો હતો.</p> <p>૨/- ઉપરોક્ત આરોપીને પકડી પાડવા શ્રી ઋષિકેશ ઉપાધ્યાય, પોલીસ અધિક્ષકશ્રી, નવસારીનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી વી.એસ.પલાસ અને પેરોલ ફર્લો સ્કોડ તથા એલ.સી.બી. પોલીસના માણસોની ટીમોને કામગીરી સોંપવામાં આવેલ.</p> <p>૩/- દરમિયાન એલ.સી.બી. પોલીસ અને પેરોલ સ્કોડને સચુંકત રીતે મળેલ હકીકત આધારે મીરાગાંવ મહારાષ્ટ્ર ખાતેથી તા. ૨૨/૧૦/૨૦૨૦ના રોજ કલાક ૨૨/૦૦ વાગે ડિટેઇન કરી કાશીમીરાં પો.સ્ટે. ખાતે કલાક ૨૩/૦૦ વાગે નોંધ કરાવી અત્રે લઇ આવી આજરોજ તા. ૨૩/૧૦/૨૦૨૦ ના રોજ કલાક ૦૫/૧૦ વાગે આગળની વધુ કાર્યવાહી અર્થે નવસારી ટાઉન પો.સ્ટે.ને સોંપવામાં આવેલ.</p>	
--	---	--

<p>નવસારી જીલ્લા એલ.સી.બી.</p>	<p>નવસારી જીલ્લા એલ.સી.બી. પોલીસ નાઓએ પેરોલ ફર્લો સ્કોડ નવસારી નાઓને તથા પોલીસ માણસોને જરૂરી માર્ગદર્શન આપી પ્રોહીબીશની પ્રવૃત્તિ ડામવા તથા પ્રોહીબીશના ગુનામાં દમણમાં નાસતા ફરતા આરોપીને પકડવા એક ટીમ ને જરૂરી સુચના આપી દમણ ખાતે મોકલેલ. જે દરમ્યાન મળેલ બાતમી આધારે ત્રણ રસ્તા , દમણ ખાતેથી નવસારી રૂરલ પો.સ્ટે થર્ડ ગુ.ર.નં.- ૩૩૩ /૨૦૧૬ પ્રોહી એક્ટ કલમ - ૬૫ એ.ઈ.૧૧૬(૨) ૮૧.૯૮.૯૯ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી શોહીલ યુસુફભાઈ ખોખર રહેવાસી - દેવકાગામ તાઈવાડ મસ્જીદ પાસે નાની દમણ નાને પકડી પાડી આગળની વધુ કાર્યવાહી સારૂ નવસારી રૂરલ પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.</p>	
<p>બીલીમોરા પો.સ્ટે</p>	<p>નવસારી જીલ્લાના બીલીમોરા પો.સ્ટે.ની પોલીસ ટીમ પ્રોહીબીશન પ્રવૃત્તિ અટકાવવા પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમી આધારે પોસરી ગામે ભુલીયા ફળીયામાં રહેતો કરસનભાઈ બુધાભાઈ પટેલ નાઓ પતાના કબ્જાની નાની હોડી (બલમ)માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ બીયરનો જથ્થો ભરી મેંધર કોળીવાડ ખાતે રહેતી ભાનુબેન રાજુભાઈ પટેલ નાને આપવા માટે અંબિકા નદીમાંથી જનાર છે. જે બાતમી આધારે મોટી બોટમાં અંબિકા નદીમાં બીલીમોરાથી પોસરી તરફ તથા નદીમાં એક નાની બોટ (બલમ) આવતા તેને નદી કિનારે લેવડાવેલ જેમાં બોટલ નંગ-૫૦૪૩ કિ.રૂ.૫૬,૬૪૦/- મળી આવેલ તથા નાની બોટ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧,૦૧,૬૫૪૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. સદર પ્રોહી મુદ્દામાલ જીએન ઈફે લાલુ અશોકભાઈ પટેલ, રહે. પોસરી ભુલીયા ફળીયા, તા.ગણદેવી જી.નવસરી નાએ આપેલ તથા સદર મુદ્દામાલ ભાનુબેન રાજુભાઈ પટેલ, રહે. મેંધર કોળીવાડ તા.ગણદેવી જી.નવસારીએ મંગાવેલ હોવાથી તે બન્નેને વોન્ટેડ જાહેર કરેલ છે.</p>	